



Market News

ભારતની અગ્રણી એનર્જી સોલ્યુશન પ્રોવાઈડર કંપની થર્મોક્સને આફ્રિકન દેશ બોત્સ્વાના તરફથી મોટો રિપીટ ઓર્ડર મળ્યો છે. એટલે કે કંપનીને પહેલાથી જ સમાન ઓર્ડર મળ્યો છે અને હવે ક્વાયન્ટે કંપનીને રિપીટ ઓર્ડર જારી કર્યો છે. આ ઓર્ડર 516 કરોડ રૂપિયાનો છે, જે અંતર્ગત બોત્સ્વાનામાં 600 મેગાવોટનો ગ્રીનફિલ્ડ એનર્જી પ્રોજેક્ટ સ્થાપિત થવાનો છે. કંપનીએ શનિવારે આ ઓર્ડર વિશે માહિતી આપી છે. આ સમાચારની અસર સોમવારે શેર પર જોવા મળશે. શુક્રવારના ટ્રેડિંગમાં શેર 2 ટકાના વધારા સાથે 4727.25 પર બંધ થયો છે.

Asian Paints Interim Dividend Record Date: Asian Paints લિમિટેડનું બોર્ડ આગામી મહિને તેની બેઠકમાં યાવુ નાણાકીય વર્ષ 2024-25 માટે તેના શેરધારકોને વચગાળાનું ડિવિડન્ડ ચૂકવવા અંગે વિચારણા કરશે. સ્ટોક એક્સચેન્જોને ફાઇલિંગમાં, કંપનીએ જણાવ્યું હતું કે મીટિંગ 23 ઓક્ટોબર, 2024 ના રોજ યોજાવાની છે. ડિવિડન્ડ અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી તેમ છતાં, તેના માટે શેરધારકોની પાત્રતા નક્કી કરવાની રેકોર્ડ ડેટ 31 ઓક્ટોબર 2024 નક્કી કરવામાં આવી છે.

જો વચગાળાનું ડિવિડન્ડ મંજૂર કરવામાં આવે છે, તો તે શેરધારકો કે જેમના નામ 31 ઓક્ટોબરના રોજ કંપનીના સભ્યો અથવા ડિપોઝિટરીઝના રજિસ્ટરમાં શેરના લાભકારી માલિકો તરીકે દેખાય છે તેઓ ડિવિડન્ડ મેળવવા માટે હકદાર બનશે. ફાઇલિંગ અનુસાર, જુલાઈ-

સપ્ટેમ્બર 2024 ક્વાર્ટરના નાણાકીય પરિણામો પર પણ બોર્ડની બેઠકમાં ચર્ચા કરવામાં આવશે અને તેને મંજૂરી આપવામાં આવશે.

દેશની સૌથી મોટી જીવન વીમા કંપની LIC એ રેલવે ટિકિટિંગ અને કેટરિંગ પ્લેટફોર્મ ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC)માં તેનો હિસ્સો વધાર્યો છે.

LIC દ્વારા તેની એક્સચેન્જ ફાઇલિંગમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, IRCTCમાં તેનો હિસ્સો વધીને 9.3 ટકા થઈ ગયો છે. જેની આજે બંને શેર પર પોઝિટિવ અસર જોવા મળી હતી. હાલમાં BSE પર, IRCTC શેર 0.99 ટકાના ઉછાળા સાથે રૂપિયા 940.60 (IRCTC શેરની કિંમત) પર છે અને LICના શેર 0.75 ટકાના ઉછાળા સાથે રૂપિયા 1039.20 (LIC શેરની કિંમત) પર છે. ઇન્ટ્રા-ડેમાં, LICના શેર રૂપિયા 1046.00 અને IRCTCના શેર રૂપિયા 956.80 પર પહોંચ્યા હતા.

એક્સચેન્જ ફાઇલિંગમાં LIC દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, IRCTCમાં તેનો હિસ્સો 16 ડિસેમ્બર, 2022થી 11 સપ્ટેમ્બર, 2024 સુધીમાં 2.020 ટકા વધ્યો છે. LICએ માહિતી આપી હતી કે તેના પોર્ટફોલિયોમાં IRCTCના શેરની સંખ્યા 5,82,22,948 થી વધીને 7,43,79,924 થઈ ગઈ છે, એટલે કે હિસ્સો 7.278 ટકાથી વધીને 9.298 ટકા થયો છે

Results & Corporate Action



Corporate Action	Company	Type & Percentage	Record Date	Ex-Date
Bonus	<u>Saksoft</u>	Bonus Ratio 1:4	19-09-2024	19-09-2024
Bonus	<u>Mindteck</u>	Bonus Ratio 1:4	20-09-2024	20-09-2024
Bonus	<u>Ujaas Energy</u>	Bonus Ratio 1:4	20-09-2024	20-09-2024
Bonus	<u>RITES</u>	Bonus Ratio 1:1	20-09-2024	20-09-2024
Bonus	<u>Phoenix Mills</u>	Bonus Ratio 1:1	21-09-2024	21-09-2024
Splits	<u>Rajshree Polypa</u>	Old FV 10 New FV 5	18-09-2024	18-09-2024
Splits	<u>Nandan Denim</u>	Old FV 10 New FV 1	19-09-2024	19-09-2024
Splits	<u>FEDDERS HOLDING</u>	Old FV 10 New FV 1	20-09-2024	20-09-2024
Rights	<u>Narmada Agrobias</u>	Rights Ratio 9:5	16-09-2024	13-09-2024
Dividend	<u>NMDC</u>	Final 150.00	17-09-2024	17-09-2024
Dividend	<u>GOCL Corp</u>	Final 200.00	17-09-2024	17-09-2024
Dividend	<u>Edelweiss</u>	Final 150.00	17-09-2024	17-09-2024
Dividend	<u>Kirloskar Ind</u>	Final 130.00	18-09-2024	18-09-2024
Dividend	<u>Mastek</u>	Final 240.00	18-09-2024	18-09-2024

Nifty Spot in Last Week:-

ઉપરમાં ૨૫૪૩૩ અને નીચામાં ૨૪૮૧૬.૦૦ નો ભાવ જોવા મળ્યો હતો.



NIFTY WEEKLY CHART



BANKNIFTY WEEKLY CHART

Nifty Fut in Upcoming Week:-

NIFTY ઉપરમાં ૨૫૫૫૫ નું resistance છે નીચામાં ૨૪૮૦૦ નો strong support છે.

Bank Nifty Fut in Upcoming week:-

BANK NIFTY ઉપરમાં ૫૨૮૦૦ નું resistance છે નીચામાં ૫૧૦૦૦ નો strong support છે.

Recommendation for next week

Serial No.	Stock Name Cash segment	Above / Below / Add HOLD	CMP as on 14.09.2024	Trail SL	Buy Stop loss	Sell Stop loss	Target
1	JAGRAN(BUY)	AROUND 94	99		89		115-130
2	NECLIFE(BUY)	AROUND 47	52.40		40		60-80
3	TTML(BUY)	HOLD 89	92		80		115-150

Commodity Market

COPPER CMP(801):- ઉપરમાં ૮૨૯ નું resistance છે નીચામાં ૭૮૦ નો support છે.



CRUDEOIL CMP(5782):- ઘટાડે ૫૪૦૦ થી ૫૧૦૦ ની રેન્જમાં ખરીદી કરી શકાય ૪૭૫૦ નો sl રાખવો ઉપરમાં ૬૩૦૦ સુધી નો ભાવ આવી શકે.

SILVER CMP(89244):- ઘટાડે ૮૨૦૦૦ ના sl થી ખરીદી કરી શકાય રાખવો ઉપરમાં ૯૫૦૦૦ સુધી નો ભાવ આવી શકે.



GOLD CMP(73510):- ઉપરમાં ૭૪૬૦૦ નું resistance છે નીચામાં ૭૨૧૦૦ નો support છે.

સંપત્તિ સંચાલન અને ત્રણગણું ગુણક અસર

અમે રોકાણકારો તરીકે એવા વેલ્થ મેનેજરની શોધમાં રહીએ છીએ જે અમને સારું ક્ષેત્ર બતાવી શકે જે અમારા માટે યોગ્ય સંપત્તિ બનાવી શકે. પરંતુ શું આપણે સમજીએ છીએ કે ‘વેલ્થ મેનેજમેન્ટ’ બિઝનેસ પોતે જ એક સારી જગ્યા છે જે આપણા માટે લાંબા ગાળાની સંપત્તિ બનાવી શકે છે. શોભિત માથુર દ્વારા લખાયેલ અને ઇકોનોમિક ટાઇમ્સમાં પ્રકાશિત થયેલો લેખ અહીં પ્રસ્તુત કરી રહ્યો છું.

(https://economictimes.indiatimes.com/markets/stocks/news/wealth-management-and-the-triple-multiplier-effect/articleshow/113143926.cms?utm_source=contentofinterest&utm_medium=text&utm_campaign=cppst)

ભારતનો વેલ્થ મેનેજમેન્ટ ઈન્ડસ્ટ્રી એક મહત્વના તબક્કામાં પ્રવેશી રહી છે, વર્તમાન એસેટ અંડર મેનેજમેન્ટ (AUM) અંદાજિત \$1-1.2 ટ્રિલિયન વચ્ચે છે. ભારત ગતિશીલ રોકાણ લેન્ડસ્કેપ સાથે સૌથી ઝડપથી વિકસતા અર્થતંત્ર

તરીકે તેના માર્ગને વેગ આપે છે, ભારતીય સંપત્તિ વ્યવસ્થાપન ઉદ્યોગ પર્યાપ્ત વિસ્તરણ માટે તૈયાર છે.

આ વૃદ્ધિ 'ટ્રિપલ મલ્ટિપ્લાયર ઇફેક્ટ' દ્વારા નિર્ધારિત છે - વધતી જતી હાઇ નેટવર્થ ઇન્ડિવિડ્યુઅલ્સ (HNIs) રોકાણકારો, સંપત્તિની પ્રશંસા અને આવકમાં વધારાની વૃદ્ધિથી બચતનો સંગમ. વધુમાં, સંપત્તિ વ્યવસ્થાપનનું ભાવિ HNI રોકાણકારોની નવી પેઢીની જટિલ જરૂરિયાતોને પહોંચી વળવા સંપત્તિ સંચાલકોની ક્ષમતા પર નિર્ભર રહેશે.

ભારતના HNIs અને રોકાણકારોનો ઉદભવ

ઉદ્યોગના અંદાજો સૂચવે છે કે ભારતમાં ઉચ્ચ નેટ-વર્થ વ્યક્તિઓ (HNIs) ની સંખ્યા વાર્ષિક 16% ના દરે વધી રહી છે અને 2027 સુધીમાં 1.67 મિલિયન સુધી પહોંચવાની સંભાવના છે. આ નવી સંપત્તિ સર્જન અને દેશમાં નવા રોકાણકારોના ઉદભવનું કાર્ય છે. . એક તરફ, ટોચની NSE 500 કંપનીઓના પ્રમોટર્સે FY23 થી સામૂહિક રીતે આશરે ₹3 ટ્રિલિયનના શેર વેચ્યા છે. પરિણામી તરલતા અને સંપત્તિની ગતિશીલતા વધતી HNIs અને UHNIs સેગમેન્ટનું સૂચક છે. બીજી તરફ, ₹10 મિલિયનથી વધુની આવક માટે ફાઇલ કરવામાં આવેલા ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR)ની સંખ્યામાં છેલ્લા એક દાયકામાં 18% ની CAGR સાથે વૃદ્ધિ થઈ છે. ITR ફાઇલિંગની કુલ સંખ્યામાં 10% વૃદ્ધિની તુલનામાં, તફાવત ઉચ્ચ આવકના વિસ્તરણ તરફ નિર્દેશ કરે છે અને HNIsની રચના માટે અગ્રણી સૂચક છે.

નોન-મેટ્રો શહેરો વિકાસ દરના સાક્ષી છે જે માત્ર હરીફ જ નથી પરંતુ, કેટલાક કિસ્સાઓમાં, મુખ્ય શહેરી કેન્દ્રો કરતાં પણ વધી જાય છે. સંપત્તિ સર્જનમાં આ ઉછાળાને કારણે આ પ્રદેશોમાં રોકાણકારોની જાગૃતિ અને રોકાણ પ્રવૃત્તિ બંનેમાં

નોંધપાત્ર વધારો થયો છે. દાખલા તરીકે, ટોચના 5 શહેરોની બહારના વિસ્તારોમાંથી મ્યુચ્યુઅલ ફંડમાં એસેટ અંડર મેનેજમેન્ટ (AUM) નો હિસ્સો નાટકીય રીતે વધ્યો છે, જે છેલ્લા એક દાયકામાં 26.6% થી વધીને 47.4% થયો છે. આ વલણ સંપત્તિના વિસ્તરતા ભૌગોલિક વિતરણને હાઇલાઇટ કરે છે, વિવિધ પ્રદેશોમાં રોકાણકારોની વિવિધ જરૂરિયાતોને સંબોધતા વધુ સમાવેશી અભિગમ અપનાવવાના મહત્વ પર ભાર મૂકે છે.

સંપત્તિની પ્રશંસા અને આવક વૃદ્ધિ

ભારતના HNIs ની રોકાણ વર્તણૂક નોંધપાત્ર ફેરફારોમાંથી પસાર થઈ રહી છે, જે પરંપરાગત અસ્કયામતોમાંથી વધુ વૈવિધ્યસભર અને અત્યાધુનિક પોર્ટફોલિયોમાં સંક્રમણ દ્વારા વર્ગીકૃત થયેલ છે. ઐતિહાસિક રીતે, રોકાણકારોએ રિયલ એસ્ટેટ અને સોના જેવી ભૌતિક સંપત્તિ માટે મજબૂત પસંદગી દર્શાવી છે. જો કે, આ બદલાઈ રહ્યું છે, HNIs તેમની સંપત્તિને નાણાકીય અસ્કયામતોમાં વધુને વધુ ચેનલ કરી રહ્યાં છે. આ ફેરફાર તેમના પોર્ટફોલિયોમાં ઇક્વિટી, જોગવાઈ અને પેન્શન ફંડ અને અન્ય નાણાકીય સાધનોની વૃદ્ધિમાં સ્પષ્ટ થાય છે.

છેલ્લા દાયકામાં HNI પોર્ટફોલિયોમાં ઇક્વિટીનો હિસ્સો 2.2% થી વધીને 4.7% થયો છે. વધુમાં, HNIs પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસિસ (PMS), વૈકલ્પિક રોકાણ ફંડ્સ (AIFs), અને ખાનગી ઇક્વિટી જેવા વૈકલ્પિક રોકાણના માર્ગોની વધુને વધુ શોધ કરી રહ્યા છે. આ ઇક્વિટી બજારોમાં વધેલા આત્મવિશ્વાસ અને તેમની સંપત્તિ ઉત્પન્ન કરવાની ક્ષમતાની ઊંડી સમજણનો સંકેત આપે છે.

આ અસ્કયામતોમાંથી સંભવિત વળતર ઇક્વિટી રોકાણો માટે ~12-15% અને બોન્ડ અને ફિક્સ્ડ ડિપોઝિટ જેવા ફિક્સ્ડ-ઇન્કમ રોકાણો માટે 7-8% ની રેન્જમાં

હોવાનો અંદાજ છે. આ વળતર એસેટ્સ અંડર મેનેજમેન્ટ પર આશરે 10% ની સરેરાશ પ્રશંસા તરફ દોરી શકે છે. એસેટ ડાઇવર્સિફિકેશનના વલણો અને HNAIsની આવકમાં વધતી જતી વૃદ્ધિથી થતી બચત સાથે, સંપત્તિ વ્યવસ્થાપન ઉદ્યોગ આગામી દાયકામાં ઘાતાંકીય વૃદ્ધિનો સાક્ષી બની શકે છે.

સંપત્તિ સંચાલકોની વિકસતી ભૂમિકા

ટ્રાન્ઝેક્શનલ અભિગમમાંથી સલાહકારી સેવાઓ પર ધ્યાન કેન્દ્રિત કરતી એક તરફ એક સ્પષ્ટ પરિવર્તન છે. વેલ્થ મેનેજરોએ વ્યક્તિગત નાણાકીય ધ્યેયો, જોખમ સહિષ્ણુતા અને HNA રોકાણકારોના જીવન તબક્કાઓને અનુરૂપ કસ્ટમાઇઝ્ડ સોલ્યુશન્સ ઓફર કરવાની જરૂર પડશે. સ્પર્ધાત્મક બજારમાં, શ્રેષ્ઠ ક્લાયન્ટ અનુભવ પહોંચાડવો એ HNAIsને આકર્ષવા અને જાળવી રાખવા માટે સર્વોપરી છે. વેલ્થ મેનેજર કે જેઓ વ્યક્તિગત ધ્યાન, સક્રિય સંચાર, પારદર્શક રિપોર્ટિંગ અને તેમના ગ્રાહકોની નાણાકીય આકાંક્ષાઓની ઊંડી સમજણ પ્રદાન કરે છે તેઓ સફળ થવા માટે વધુ સારી સ્થિતિમાં હશે.

છેલ્લે, જો આપણે યુ.એસ. પર નજર કરીએ, તો સંપત્તિ અને વૈકલ્પિક સંપત્તિ ઉદ્યોગનો કુલ નફો મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગના 3-4 ગણો છે. તેનાથી વિપરિત, ભારતમાં વેલ્થ મેનેજરો માટેનો પ્રોફિટ પૂલ એસેટ મેનેજર્સનો અડધો ભાગ છે. સમય જતાં,

HEAD OFFICE

B/230-231, International Trade Center, Majura Gate, Ring Road, Surat-2. (Guj.) India Ph: 0261-40 60 750,
246 27 90 Fax: 0261-246 27 91 www.markethubonline.com E-Mail: info@markethubonline.com

IA SEBI REGISTRATION NO.:INA000005333

Disclaimer:

We do not represent that information provided by us is accurate or complete and it should not be relied upon as such. The advice provided here is just for knowledge purpose only. The user assumes the entire risk of any use made or not made of this information.

INVESTMENT IN EQUITY, MUTUAL FUND, EQUITY, CURRENCY & COMMODITY DERIVATIVES IS SUBJECT TO RISK. WE ARE DISTRIBUTOR OF MUTUAL FUND Client should read the Risk Disclosure Document (RDD) & Do's and Don'ts issued by SEBI & relevant exchanges before investing